



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦,૨૫૬૩૦૩૦૦,૨૫૬૩૦૪૦૦

ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૦/૧૧/૨૦૧૪ ગુરૂવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

શહેર પોલીસ ધ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:-

સમાચાર યાદી ૨૮૪૪/૧૪

નરોડા દહેગામ રીંગ રોડ સર્કલ પાસેથી પસાર થતી આઈસર ટ્રકમાંથી ઈંગ્લિશ દારૂ તથા બિયર ની કુલ બોટલો નંગ ૬૧૪૩ કુલ કિ.રૂ. ૨૧,૨૯,૯૦૦/- નો જથ્થો પકડી પાડતી કાઈમ બ્રાન્ચ પોલીસ

સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી, એ.કે.શર્મા તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી હિમાંશુ શુક્લા તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી એમ.ડી.ચૌધરી નાઓએ અસરકારક પ્રોહીબિશનની કામગીરી કરવા આપેલ સુચના અન્વયે પો.ઈન્સ.શ્રી આર.બી.રાણા તથા પો.સ.ઈ.શ્રી જે.એન.ઝાલા તથા સ્ટાફના માણસો અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નરોડા દહેગામ રીંગ રોડ સર્કલ પાસે સ્ટાફના એ.એસ.આઈ. અરવિંદકુમાર સોમાભાઈ તથા વસંતભાઈ જીવાભાઈ નાઓએ આપેલ બાતમી આધારે આઈસર ટ્રક નં. GJ-01-DT-9630 ને નાકાબંધી કરી રોકી તેમા જડતી તપાસ કરતા કોબીજ, કુલાવાર તથા સિંગોડાના પાંદડાના થેલાઓ નીચે સંતાડેલ ઈંગ્લિશ દારૂની બોટલ નંગ - ૨૫૯૧ તથા બિયરના ટીન નંગ - ૩૫૫૨ મળી કુલ રૂ. ૨૧,૨૯,૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ડ્રાયવર મોહમદનૌસાદ મોહમદ દિલસાદ કુરેશી ઉવ.૩૦, રહે. તીમનદાસ, સરાઈ, તા.જી.સમ્બલ, ઉત્તરપ્રદેશ તથા કલીનર મોહમદઆલમ મોહમદનશીમ કુરેશી ઉવ.૨૩, રહે. નાલા મહેલ્લા, સરાઈ, તા.જી.સમ્બલ, ઉત્તરપ્રદેશ તથા મોહમદજાવેદ મોહમદમહેમુદ કુરેશી ઉવ.૨૩, રહે. નવો વાસ, મીરઝાપુર કોર્ટ પાછળ, અજીમભાઈના મકાનમાં અમદાવાદ તથા મુળ વતન- હવાસકા સરાઈ, તા.જી.સમ્બલ, ઉત્તરપ્રદેશ નાઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેઓની વધુ પુછપરછ કરતા ઉપરોક્ત ઈંગ્લિશ દારૂનો જથ્થો હરિયાણા, ગુડગાંવ ખાતે એક દારૂના ગોડાઉનમાંથી મનીષ નામના માણસે ભરાવેલ હતો અને નડિયાદ ખાતે ડીલીવરી કરવાનો હતો જે આગળની વધુ તપાસ ચાલુ છે.

વટવા પો.સ્ટે.:-

વટવા પો.સ્ટે. ફ.ગુ.ર.નં ૨૯૫/૧૪ ઈપીકો કલમ ૩૬૩,૩૬૬ મુજબ ના કામના આરોપી દુષ્ચંતગીરી ચંદુગીરી ગોસાઈ ઉ.વ.૨૬ રહે.મહાદેવ ફળીયુ ના મંદીર પાસે નારોલ ગામ નારોલ અમદાવાદ શહેર નાને સીની.પો.ઈન્સ.શ્રી એચ.જે.ચૌધરી સા.નાઓએ તા.૧૯/૧૧/૨૦૧૪ ના કલાક ૧૧/૧૫ વાગે પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

નાયબ પોલીસ કમિશનર
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર
પોલીસ કમિશનર વતી.